

હેલ્પલાઇન: ૧૦૪



COVID-19 અખબારી યાદી ક્રમાંક: ૧૪૧

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,
ગાંધીનગર.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૮૧૮

ઈ-મેલ: ssoidsp@gmail.com

તા.૨૮.૦૫.૨૦૨૦

★★★★★

આજ રોજ રાજ્યમાં COVID 19 કુલ-૩૬૭ નવા દર્દીઓની સામે કુલ-૪૫૪

દર્દીઓ સાજ થઈને ઘરે ગયેલ છે

રાજ્યમાં આરોગ્ય સેવાઓ પૂર્વવત

લોકડાઉન દરમ્યાન રસીકરણથી વંચિત રહી ગયેલ બાળકો અને સગર્ભાઓને ચાલુ

માસ માં જુંબેશ હાથ ધરી રસીકરણ અને અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવી જે

અંતર્ગત ૨,૭૭,૯૮૦ સગર્ભા માતા અને ૩,૦૧,૭૬૩ બાળકોને આવરી લેવાયા.

★★★★★

આજ રોજ રાજ્યમાં કુલ-૪૫૪ દર્દીઓ સાજ થઈને ઘરે ગયેલ છે. જેમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૩૮૧ દર્દીઓને અને ત્યારબાદ સુરત જિલ્લામાંથી ૨૧ દર્દીઓને રજા આપવામાં આવેલ છે. આ ઉપરાંત કચ્છ- ૧૨, અરવલ્લી - ૧૦, ગાંધીનગર -૭, પાટણ- ૬, જામનગર- ૪, જુનાગઢ- ૩, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠા-૨-૨, ખેડા અને વલસાડ-૧-૧ દર્દીઓને સાજ થતા રજા આપવામાં આવેલ છે.

આજ દિન સુધી રાજ્યમાં કુલ ૮૦૦૩ દર્દીઓ સારી અને ગુણવત્તા સભર સારવારના પરિણામે સાજ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે.

આજ રોજ રાજ્યમાં અમદાવાદ -૨૪૭, સુરત-૪૪, વડોદરા-૩૩, મહીસાગર-૦૮, કચ્છ- ૦૭, રાજકોટ-૦૭, ગાંધીનગર - ૦૪, આણંદ, પંચમહાલ ૨, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, જોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે ૧-૧ કેસ એમ રાજ્યમાં કુલ ૩૬૭ નવા કેસ નોંધાયેલ છે જેની સામે ૪૫૪ દર્દીઓ ને સાજા થતા રજા આપવામાં આવેલ છે. આમ, હાલ રાજ્યમાં કુલ ૬૬૧૧ એક્ટીવ કેસ છે.

રાજ્યમાં અમદાવાદ - ૧૬, વડોદરા- ૩, કચ્છ, પાટણ, અને સુરેન્દ્રનગર ખાતે ૧-૧ મરણ આજ રોજ કોવિડ-૧૯ નાં કારણે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ ૯૬૦ મરણ થયેલ છે.

કોવિડ-૧૯ માટે રાજ્યમાં જુદી જુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ ઉપરાંત ICMR ની ગાઈડલાઈન મુજબ જિલ્લાઓમાં કુલ ૧,૯૮,૦૪૮ ટેસ્ટ કરવામાં આવેલ છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે.

એક્ટીવ કેસ			ડીસ્ચાર્જ	મૃત્યુ
કુલ	વેન્ટીલેટર	સ્ટેબલ		
૬૬૧૧	૭૬	૬૫૩૫	૮૦૦૧	૯૬૦

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ ૩,૧૩,૭૨૯ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવેલ છે. જે પૈકી ૩,૦૫,૪૪૩ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન તથા ૮,૨૮૬ વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવેલ છે.

લોકડાઉનના સમયગાળા દરમ્યાન રસીકરણની સેવાઓને સ્થગિત કરવામાં આવી હતી. જે સેવાઓને મે માસના પ્રથમ અઠવાડિયાથી પુર્વવત કરવામાં આવી હતી. પરંતુ અગાઉના સમયગાળા દરમ્યાન વંચિત રહી ગયેલા બાળકો અને સગર્ભાઓને આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ હાથ ધરી રસીકરણ અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી ચાલુ માસ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૨,૭૭,૯૮૦ સગર્ભા માતા અને ૩,૦૧,૭૬૩ બાળકોને સેવાઓ પૂરી પાડવામાં આવી. આમ રાજ્ય સરકારે આ કપરા કાળમાં પણ આવશ્યક સેવાઓ પૂરી પાડી છે.